

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૯/૯/૨૦૧૫ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર
શહેર પોલીસ ધ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:- સમાચાર યાદી નં.૧૮૯૨/૧૫

અમદાવાદ તથા ગાંધીનગર વિસ્તારમાંથી પ્લાયવુડ તથા સોફા તેમજ ગાદીના બેડશીટની દુકાન ધરાવતા વેપારીઓને ફોન કરી વિશ્વાસમાં લઈ જથ્થાબંધ માલ મંગાવી જે માલ બારોબાર વેચી મારી તેના નાણાં મેળવી છેતરપિંડી કરનાર ઇસમને પકડી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ.

નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાંચ તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાયબર સેલ નાઓની સુચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.રાહોડ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.પી.રોજીયા નાઓ સ્ટાફના માણસો સાથે મોલ્કત સંબંધી ગુન્હાઓ શોધવા માટે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે રાજેશભાઈ શાંતીલાલ શાહ ઉ.વ. ૪૫ રહે. આઈ/૨૦ અક્ષત એપાર્ટ, પુજન પાર્ટી પ્લોટ સામે, ભુયંગદેવ મેમનગર રોડ અમદાવાદ નાને ૧)- લાલ કલરનુ યુ-ફોમ જે પ્લાસ્ટીક કવરમાં જે ૬'-૬' સાઇઝ ના માપનુ ૪'' ઇંચની યુ-ફોમની શીટ નંગ-૪ તથા લાલ કલરનુ યુ-ફોમ જે પ્લાસ્ટીક કવરમાં જે ૬'-૫' સાઇઝ ના માપનુ ૪'' ઇંચની યુ-ફોમની શીટ નંગ-૪ તથા પીળા કલરનુ યુ-ફોમ જે પ્લાસ્ટીક કવરમાં જે ૬'-૩' સાઇઝ ના માપનુ ૨'' ઇંચની યુ-ફોમની શીટ નંગ-૬ તથા કાળા કલરનુ યુ-ફોમ જે પ્લાસ્ટીક કવરમાં જે ૬'-૩' સાઇઝ ના માપનુ ૧'' ઇંચની યુ-ફોમની શીટ નંગ-૧૫ તથા ફેવીકોલ ના બે ટીન છે.જેમાં પાંચ-પાંચ લીટર જેટલો ફેવીકોલ સીલબંધ હાલતમાં તથા માદરપાટ નુ કાપડ આશરે ૪૦ મીટર લંબાઈ જેટલુ જે કુલ્લે કિં.૩-૫૭,૩૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. જે બાબતે મણીનગર પો.સ્ટેશન ફર્સ્ટ ગુ.રજી.નં-૧૪૮/૧૫ ઇપીકો ક-૪૦૬,૪૨૦ વિ. મુજબ નો ગુન્હો શોધાયેલ છે. તેમજ સદરી આરોપીને વિશ્વાસમાં લઈ પુછપરછ કરતા અમદાવાદ શહેર તથા ગાંધીનગર તેમજ આજુબાજુ વિસ્તારમાં પ્લાયવુડ તેમજ સોફા તેમજ ગાદીના બેડશીટ ની દુકાન ધરાવતા વેપારીઓને ફોન કરી વિશ્વાસમાં લઈ જથ્થાબંધ માલ મંગાવી જે માલ બારોબાર વેચી મારી તેના નાણાં મેળવી છેતરપિંડી કરી પકડાઈ ગયેલ છે. અને આરોપીના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાંથી અંદાજીત ૩૦ થી ૩૫ જેટલી દુકાનોમાંથી આ રીતે માલ મેળવી ચીટીંગ કરેલાનુ જણાવેલ છે. જેની તપાસ પો.સ.ઇ. જે.પી.રોજીયા ચલાવી રહેલ છે.

નાયબ પોલીસ કમિશ્નર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશ્નર વતી.